



પાટણ પ્રતિબિંબ

વર્ષ ૮ • અંક ૪ • સળંગ અંક ૮૭ • મુંબઈ • ફેબ્રુઆરી ૨૦૧૪ • પાના ૧૨
છૂટક નકલ રૂા. ૨/- RNI. Regd. No. MAHGUJ/2006 / 18379

શ્રી પાટણ જૈન મંડળનું મુખપત્ર

ટેલિફોન : 2281 1346 • ટેલિફેક્સ : 22811218 • www.patanmandal.org • Email : patanmandal@gmail.com

પ્રમુખસ્થાનેથી...

સ્નેહી સ્વજનો,
જય જિનેન્દ્ર!!

*વર્ષા અને વસંત એ ભિતર્યા પ્રેમની ઋતુ છે,
ઈશ્વરના હસ્તાક્ષરે મેઘધતુષ રચાય છે,
મોસમ છલકે છે અને હૈયા મલકે છે,
ભીલો સ્પર્શ પરિભાષા પ્રેમની સરજે છે.*

Happyness is the homework of social service.
સમાજિક કાર્ય કરવું તે દરેક માનવીને ઈશ્વર તરફથી મળેલ હોમવર્ક છે. ઉપકૃતના પરિચય વગરનો ઉપકાર જ સાચો ઉપકાર છે. The orient philosopher says what I gave, I held, what I spent I had, What I kept, I lost!

ભૂખ પ્રેમની, વિચારની, સદ્ભાવની, ભલાઈની પણ હોય છે. અન્ન અને ધનની દરિદ્રતા જેવી જ મોટી આ દરિદ્રતા છે, જે માનવીને અસહ્ય દુઃખ આપનારી છે.

આત્મા પ્રેમનો બનેલો છે, તે પ્રેમ કરવા અને તેનો પ્રતિસાદ મેળવવા સતત ઝંખે છે અને તેમાં અને ત્યારે જ પરિપૂર્ણતા અનુભવે છે. અકારણ, નિઃસ્વાર્થ પ્રેમ જ આપણું સાચું નિવાસસ્થાન છે.

આધુનિક ભૌતિકવાદી સ્પર્ધાત્મક જીવનશૈલી મહત્વાકાંક્ષાને આગ આપે છે, જેમાં કુલ જેવી નાજુક ઝંખના સળગી જાય છે. સંબંધ બંધાય ત્યારે આપણે વચનબધ્ધ સ્થિતિમાં હોઈએ છીએ, જે આપણી પ્રેમ કરવાની ક્ષમતાનો ઉઘાડ કરવાનું વચન છે. આપણા આત્માની તરસ અને અસ્તિત્વનો અર્ક છે.

પ્રેમને તેના ઉડાણ, વ્યાપ અને ઉંચાઈ થકી અર્થપૂર્ણ અને મજબુત બનાવે છે. પ્રેમ અને જ્ઞાન બન્ને અલગ માર્ગ છે એ તેનો સંગમ થાય તો સ્વર્ગ અહીં જ છે.

વિરલ સખાવતી શ્રીમતી પન્નાબેન સોનાવાલાના ફલેટ-ગેરેજ સંસ્થાને નામે

વિરલ સખાવતી શ્રીમતી પન્નાબેન સોનાવાલાના મલબાર હીલનો ફલેટ તથા ગેરેજ તેમના વીલની રૂએ શ્રી પાટણ જૈન મંડળના નામે ટ્રાન્સફર થયેલ છે. વેચાણ માટેની જાહેરખબર પ્રતિબિંબમાં અન્યત્ર પ્રકાશિત કરેલ છે. શ્રીમતી પન્નાબેનના આવા અનુમોદનીય અને અનુકરણીય સુકૃત માટે સમાજ તેમની સ્મૃતિને ક્યારેય વિસ્મૃત નહીં કરે.

શ્રીમતી પન્નાબેન પોતાની સ્થાવર-જંગમ મિલકત તેમની હયાતી બાદ તેમનો વારસો શ્રી પાટણ જૈન મંડળને મળે તેવી તેમની ભાવનાને હકીકતમાં ફેરવવા વીલ બનાવતી વખતે તેમના સી.એ. શ્રી કિશોરભાઈ દલાલના સલાહ સૂચનને અનુસર્યા હતા. તેમના

આ અંકના સૌજન્ય દાતા



શ્રીમતી લતાબેન અને શ્રી રમેશચંદ્ર મોતીલાલ શાહ પટ્ટિવાર (કટકીયા વાડો)



Reshmo Mac Tools Centre

84/86, Abdul Rehman Street, Gr. Floor, Opp. SBI, Mumbai-400003

Phone : 2342 7801, 2341 0364 + Mobile : 98200 38275, 93225 22008

જીવન પહેલા, સાથે અને પછી માતા-પિતાની આશિષ ઝંખતા...કૃતિ-સંદીપ

★ વધ ૩૪ ★ સળંગ અંક ૪૧૪★

યોગ્ય સહકાર, સલાહને કારણે જ શ્રીમતી પન્નાબેન આવો અભૂતપૂર્વ નિર્ણય લઈ શક્યા હતા. જેના શ્રી નવીનભાઈ ગુંદરવાલા, પ્રમુખશ્રી દિનેશભાઈ રસિકલાલ શાહ, શ્રી મહેન્દ્રભાઈ નેમચંદ શાહ, ટ્રસ્ટી શ્રી ભરતભાઈ નેમચંદ શાહ નખશીખ સાક્ષી છીએ

તે સાથે શ્રીમતી પન્નાબેનના પરિવારના માંદગી તથા ઓપરેશન સમયે શ્રી રમેશભાઈ કોટાવાળા, શ્રી નયનેશભાઈ બાબુલાલ શાહ, શ્રીમતી ભગવતીબેન, શ્રીમતી નિર્મળાબેન વિનોદભાઈ, શ્રીમતી માલતીબેન, શ્રી ભુપેન્દ્રભાઈ (યુ.એસ.એ.), શ્રી અમીતભાઈ, શ્રી કલાબેન, શ્રી હર્ષદભાઈ ગોકળભાઈ, શ્રીમતી જયોતિબેન હર્ષદભાઈ, શ્રીમતી સ્મિતાબેન વિક્રમભાઈ વગેરેએ સંપૂર્ણ સહકાર આપેલ હતો, તે બદલ સંસ્થા આ સર્વનો આભાર માને છે. વીલ બનાવવા તેમજ હકારાત્મક અભિગમ સાથેના વિચારોની પૂર્તિ કરવા બદલ શ્રી કિશોરભાઈ સી. દલાલ (સી.એ.)નો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

દાનગંગાના પ્રવાહ :

સિધ્ધાંત અને સંકલ્પ સાથે સંબંધના સમીકરણો સાચવી ગમતા અને મમતાનો ગુલાલ કરનાર શ્રી પાટણ જૈન મંડળની અનેકવિધ પ્રગતિ અને પ્રવૃત્તિને લક્ષમાં લઈ સખાવતનું પ્રમાણ અવિરત ચાલુ રહ્યું છે. ખજુરીના પાડાના અગ્રગણ્ય દાતા પરિવારના બાબુ હર્ષભાઈ તથા બાબુ નરેન્દ્રભાઈએ, પનાલાલ પુનમચંદ ચેરીટેબલ ફંડ તરફથી સંસ્થાને રૂ.૭,૦૦,૦૦૦/- નું દાન રીવોલ્વીંગ ફંડ અંતર્ગત પાઠવેલ છે. તેઓ તરફથી સંસ્થાને સતત દાન મળતા રહ્યા છે, જેમાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. સંસ્થા આ મહાનુભાવોની સાભાર ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે.

શ્રી ગિરનારજી યાત્રા-પ્રવાસ :

શ્રીમતી કાંતાબેન તથા શ્રી મંગુલાલ અમથાલાલ શાહના આત્મશ્રેયાર્થે શ્રી પાટણ જૈન મંડળ આયોજીત શ્રીમતી ચંદ્રીકાબેન રજનીકાંત શાહ (ડીસાવાળા-કોકાનો પાડો) પ્રેરીત શ્રી ગિરનારજી યાત્રા-પ્રવાસ શુક્રવાર, તા.૨૧-૦૨-૨૦૧૪ થી મંગળવાર, તા.૨૫-૦૨-૨૦૧૪ સુધી સુનિશ્ચિત થયેલ છે. ખુબ જ ટૂંકા સમયમાં ઉક્ત યાત્રા-પ્રવાસની તૈયારી માટે સતત કાર્ય કરનાર કાર્યકરો તથા હોદ્દેદારો અને સંસ્થાના કાર્યાલયના સભ્યોને સફળતા માટે હું શુભેચ્છા પાઠવતા સહર્ષ આનંદ અનુભવું છું. સૌજન્ય દાતા શ્રીમતી ચંદ્રીકાબેન તથા શ્રી રજનીભાઈને તેમના સુકૃત માટે સહર્ષ હાર્દિક અભિનંદન!

દિશા-વિડલાંગ પ્રવાસ :

સંસ્થાના મેઘાવી દાતા પરિવાર સેવંતીલાલ કાંતીલાલ ટ્રસ્ટ તરફથી દિશાના ૨૯ બાળકો સાથે કુલ ૮૫ જણા માટે મૈસુર, બેંગ્લોર અને કૃષ્ણાગિરિનો યાત્રા-પ્રવાસ તા.૨૫-૦૧-૨૦૧૪ થી તા.૩૦-૦૧-૨૦૧૪ દરમ્યાન રંગેચંગે સંપન્ન થયો. દિશાના બાળકો માટે દિશા

ઉત્કૃષ્ટ કાર્ય કરી રહી છે. દાતા પરિવાર તથા દિશાના મંત્રીઓ શ્રીમતી પ્રમીલાબેન ભદ્રકાંત શાહ, શ્રીમતી હીનાબેન યશમુખભાઈ શાહ તથા શ્રી ભદ્રકાંત પ્રેમચંદ શાહ તથા કાર્યકરોને ઉક્ત પ્રવાસની સફળતા બદલ મનનીય અનુમોદના. સૌજન્ય દાતા પરિવારના શ્રીમતી પ્રફુલ્લાબેન લલીતભાઈ શાહ, શ્રીમતી મૃદુલાબેન, શ્રીમતી નીતાબેન, શ્રીમતી આશાબેન તથા શ્રી પ્રફુલભાઈ કાંતીલાલ શાહે યાત્રા-પ્રવાસમાંની સ્વદેખરેખ રાખી હતી. તેઓ સર્વની સંસ્થા તરફથી ખુબ ખુબ અનુમોદના! Holiness and Happyness go to gather. જાણકારી અને સમજદારી જિંદગીમાં મહત્વનો ભાગ ભજવે છે. સાધારણ વાત અસાધારણ બની અપ્રતિમ લોકપ્રિયતા પ્રાપ્ત કરે છે.

પ્રતિબિંબ સ્પોન્સર યોજના :

પાટણ પ્રતિબિંબમાં આવેલ વિનંતીને હકારાત્મક પ્રતિસાદ પ્રાપ્ત થયેલ છે. મે.રેશમો મેક ટુલ્સના શ્રી સંદીપભાઈ રમેશભાઈ શાહે ત્રણ સ્પોન્સરશીપ જાહેર કરી છે. તેઓની આ ઉત્કૃષ્ટ વિચારધારાનું શ્રેય તેઓ પિતાશ્રી રમેશભાઈના આશીર્વાદને આપે છે. અન્ય ત્રણના વચન પણ પ્રાપ્ત થયેલ છે. વધુ વધુ સ્પોન્સરો સહર્ષ આવકાર્ય છે. સંસ્થા મે. રેશમો મેક ટુલ્સનો સહર્ષ આભાર માને છે.

ચાલો થોડું માણસ માણસ રમીએ,
તમીએ રાતે એક બીજાને ગમીએ,
સુખ દુઃખને સાથે ખમીને કહીએ
ફીકરની કરીએ ફાકી, મੈં હું ના!

બધો આધાર ઈશ્વર પર હોય તેમ પ્રાર્થના કરો!
બધો આધાર તમારા પર હોય તેમ કામ કરો!
આભાર...!

પ્રમુખ રાતે મેનેજીંગ ટ્રસ્ટી
શ્રી પાટણ જૈન મંડળ

પાટણ જૈન સમાજ જોગ

સંસ્થા દ્વારા તાજેતરમાં જ પ્રકાશિત થયેલ સાતમા વસતીપત્રકમાં છપાયેલ સરનામા મુજબ હવેથી દરેક કુટુંબોને દર માસે પ્રતિબિંબ મોકલવામાં આવશે. તો દરેકે પોતાનું સરનામું જોઈ તપાસી તેમાં સુધારા-વધારા કે ફેરફાર હોય તો, પાટણનો મહોલ્લો, રહેઠાણનું સરનામું, કુટુંબના વડીલનું નામ લખી જણાવશો. જે કુટુંબીજનોનું નામ આ વસતીપત્રકમાં છપાયેલ ન હોય, તેમને પ્રતિબિંબ મેળવવા માટે વસતીપત્રક માહિતી ફોર્મ ભરવું જરૂરી છે, ત્યારબાદ જ તેઓને પ્રતિબિંબ મોકલવામાં આવશે, જેની નોંધ લેશો. આ અંગેની વિગત રૂબરૂ, પત્રથી અથવા patanmandal@gmail.com માં ઈમેલ દ્વારા સંસ્થાના કાર્યાલયમાં જાણ કરશો.

તંત્રીસ્થાનેથી...

Will You Be My Valentine???

પ્રેમ એટલે શક્તિ-જગતના સર્વ સદ્ગુણોનું ઉદ્દગમ સ્થાન પ્રેમ જ છે. દુઃખ અને દર્દને સંતાપમાંથી સુખમાં ફેરવવા પ્રેમથી વધુ અન્ય કોઈ તાકાત નથી. ખરા શબ્દોમાં અશ્રુ, સ્મિત, મૌન આ સઘળું પ્રેમમાંથી જ ઉદ્ભવે છે. લાગણી કે લગનીને શબ્દોની કે ભાષાની આવશ્યકતા નથી હોતી. વ્હાલ કે વ્હાલપ આંખોમાંથી જ સરી પડે છે, નીતરે છે કે ઉભરાય છે. તેને વ્યક્ત કરવાની જરૂર પડતી નથી, આપોઆપ વ્યક્ત થઈ જાય છે, સાચુ કહો તો અવ્યક્ત પ્રેમ પણ ઘણું બધુ કહી જાય છે, નવજાત શીશુ તેની આંતરભાવનાઓ સ્પર્શ અને ચક્ષુ દ્વારા જ વ્યક્ત નથી કરતું?

પ્રણય કે પ્રેમની ભાષા ઈન્દ્રિયો, હૃદય અને મસ્તક પર એક સાથે ત્રિપાંખિયો હુમલો કરે છે, કદાચ તેથી જ તે બળવત્તર કહેવાય છે. માનવીનું શરીર લાલસા, વાસના કે ભૌતિક વિચારો ક્યારેક અંધાપો અનુભવે પણ આત્મા ક્યારેય નહીં. વિશ્વાસમાંથી પ્રેમ નહીં, પ્રેમમાંથી વિશ્વાસ ચોકકસ ઉદ્ભવી શકે. પ્રેમ હકક નથી માગતો કર્તવ્ય અને ફરજ પર અવલંબે છે. પ્રેમ એટલે મૈત્રી, સંવાદ, એકત્વ અને સમજદારી વિચારોના વમળ કરતાં કાર્યના કામકાજનું મહત્વ સવિશેષ છે. પ્રેમ જ મંગલમય, સુખમય, નિરામય જીવનનો પાયો બની શકે! હરીન્દ્ર દવેના શબ્દોમાં કોઈનો પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો આપણી અપેક્ષાઓ વધારે હોય છે. ડૉ. હેમેન શાહના શબ્દોમાં હું એ બધી જ ઉર્મિઓની માફી માગુ છું, શબ્દોનું રૂપ જેને હું આપી નથી શકતો.

- ટીકા એ કીર્તિની કમાણી પરનો સામાજિક કર છે.
- લોકો આપણા માટે શું વિચારે છે એ પણ આપણે જ વિચારીએ તો તેઓ શું વિચારશે ?
- He has a right to criticise who has heart to help others.
- જ્યાં સુધી તમારુ અંતઃકરણ તમારો મિત્ર છે, ત્યાં સુધી તમારે દુશ્મનોની ફીકર કરવાની જરૂર નથી.

પ્રેમ સાદ પ્રતિસાદ માગે છે. ઘણી વખત પ્રેમ જ્યારે શબ્દમાં વ્યક્ત થાય છે, ત્યારે અસીમ બની જાય છે અને અસીમ પ્રેમ અમાપ અને અગણિત હોય છે. જેની પ્રવિત્રતાનો પમરાટ ચોમેર પ્રસરી રહે છે. હૃદયના ગર્ભગૂહમાં ઝળહળતો દીપક શૂન્યથી પુણ્ય તરફ અને રણથી શ્રવણ તરફ દોરવાની શક્તિ ધરાવે છે. પળે પળે પામર પુરવાર થનારનો પરમ તો સનાતન જ હોય છે. ક્ષિતિજ એક જ હોવા છતાં ઈશ્વરની સ્મૃતિ પ્રાર્થના બની જાય છે. માટે નિચોવાયેલી નિખાલસતામાં બુધ્ધિપૂર્વકની સમજણથી પ્રગટેલી વાસ્તવિકતા નજરે પડ્યા વગર રહેતી નથી.

મૃગજળ પાસે પ્રેરક કે આકર્ષક સત્ય સંભવી ન શકે તેથી તાત્વિક કે સાત્વિકની અપેક્ષા કેવી રીતે કરી શકાય? ઘણી વખત આપણે કોઈને વાંચ્યા ન હોય કે મળ્યા ન હોઈએ તો પણ બન્નેની વાતો એક સરખી હોઈ શકે છે, તેનું કારણ એ હોય છે કે પ્રેમ અને લાગણીને જો સમજીએ કે સમજવાના પ્રયત્નો કરીએ તો તેની ભાષા બહુધા એક જ હોય છે.

પળે પળે પામર પુરવાર થનારનો પરમ તો સનાતન જ હોય છે.

ક્ષિતિજ એક જ હોવા છતાં ઈશ્વરની સ્મૃતિ પ્રાર્થના બની જાય છે. માટે નીચોવાયેલી નિખાલસતામાં બુધ્ધિપૂર્વકની સમજણથી પ્રગટેલી વાસ્તવિકતા નજરે પડ્યા વગર રહેતી નથી, તે ખીલે છે અને ખુલે છે.

પ્રેમ અને પ્રાર્થના બન્નેની ફળશ્રુતિ, ક્ષમતા અને સ્વીકાર જ હોઈ શકે. દિશાશૂન્ય દશાને સાચો માર્ગ દર્શાવવાની ક્ષમતા તેમાંથી જ પ્રાપ્ત કરી શકાય. કાર્ય કરનાર વ્યક્તિની ભૂલ થવાની શક્યતા હોઈ શકે છે. પ્રયત્ન અને ભૂલ જ જીવનમાં પથસારથિ બને છે. શ્રમ અને શ્રદ્ધાપૂર્વક આચરેલા કાર્યને અચૂક સફળતા મળે છે, પરંતુ પ્રત્યેકને તેનો એક સમય હોય છે. જીવનમાં જે સમયે જે અને જેવું મળે તેનો જ સ્વીકાર કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેતો નથી.

આપણે આપણામાં પ્રવેશી પ્રેમનો એકરાર કરીએ તો તે વધુ આત્મિય થઈ આપણને સ્પર્શી અદ્વિતીય પ્રતિસાદ કે પડઘો આપ્યા વગર રહેતો નથી.

પ્રેમની વ્યાખ્યા અવર્ણનીય છે. શબ્દો કદાચ ઓછા પડે. સાચવી, સંભાળી પદપ્રયાણ કરીએ તો અમૃત લાગશે અને પ્રત્યેક નિશા મીઠો ઉજાગરો કરાવશે નહીં તો ક્યારેક ઉતાવળે લીધેલ ખોટો નિર્ણય કે પગલું જીવનને ઝેર બનાવતા વાર નહીં લગાડે. પ્રેમને સમયના બંધન નડતા નથી. સાન્નિધ્યની પ્રત્યેક પળો પ્રેમમાં તરબતર લાગે, વસંત પણ કદાચ અધૂરી લાગે. ક્યારેક છલકતી આંખોમાં અશ્રુનો ધોધ પણ ખૂટી પડે. પ્રેમની પરિભાષા અને અભિભાષા લાગણીઓથી અનુભવાય, વિચારધારાને અનુસરાય અને નિભાવીને જ પ્રેમ શક્ય બને.

ઈશ્વરદત્ત મળેલ આ બક્ષિસ હૈયાથી હૈયાને જોડતો સેતુ બને છે અને જીવનના આપરી મુકામ સુધી સશક્ત રાખે છે. સંબંધો એવા હોવા જોઈએ કે જેમાં શબ્દો અલ્પ હોય અને સમજ વધારે હોય, વિવાદ કરતા સ્નેહ વિશેષ હોય અને શ્વાસ કરતાં વિશ્વાસ વધુ હોય. પાનખરમાં વસંત બહાર લાવે તે જ પ્રેમ!

પાનગી ખજાના સમ આ મહામૂલો પ્રેમ છે. સંપૂર્ણ પ્રેમ પામવા ક્ષણના આગમનની રાહ ના જોશો પણ ક્ષણને તમારામાં સમાવી તેને જ સુવાસમય અને સંપૂર્ણ બનાવો. ત્યારે અને ત્યારે જ તમે કહી શકશો Will you be my Valentine???

□ સંપાદક સમિતિ

શ્રીમતી પદ્માબેન કપૂરચંદ સોનાવાલાની
અનુમોદના અને દાતા શ્રીઓનો અભિવાદન સમારોહ
શ્રી પાટણ જેન મંડળ દ્વારા ઉપરોક્ત સમારોહનું આયોજન રવિવાર, તા. ૨-૦૩-૨૦૧૪ ના સવારે ૯.૩૦ કલાકે, પાટકર હોલ, મરીન લાઈન્સ મધ્યે કરવામાં આવેલ છે. આ અભિવાદન સમારોહમાં સંસ્થામાં માતબર રકમની સખાવત - અનન્ય યોગદાન આપનાર દાતાશ્રીઓના પરિવારોનું 'સ્મૃતિચિહ્ન' દ્વારા અભિવાદન કરવામાં આવનાર છે. આ અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ પત્રિકા દાતાશ્રીઓને મોકલાવી આપેલ છે. આમંત્રીતોને સમયસર ઉપસ્થિત રહેવા વિનંતી.

□ શ્રી પાટણ જેન મંડળ

Life Is A Tightrope Walking

By Maulana Wahiduddin Khan

Living life is like tightrope walking. Tightrope walking means maintaining your balance between two opposite positions, proceeding very cautiously so that you avoid either of two equally bad situations.

The word 'tightrope walk' was initially coined for an act of derring-do entertainment, that is, a tightrope is a tightly stretched wire or rope fixed high above the ground on which someone walks across in order to entertain people. But the spirit of the tightrope walk, that is, maintaining a balance between two opposites, is a great principle in real life.

You like sweet food items but your doctor says that you are diabetic, so you have to avoid sweets. In this case you will try to find a balance between your desire and the doctor's advice. At home, you experience a disturbing situation, but when you are in your office, you feel that you have to deal with office affairs with a cool mind, so you try to find a balance between two contrary mental states. You are walking on the road, and a scooter driver hits you. Naturally, you become angry and you want to beat him up, but you think that if you turn violent, the police will arrest you and take you to jail, so you try to control your emotions. In your business, you have suffered loss and have fallen into despair, but you think: 'I have lost the present, and if I give in to despair, I will lose the future also.' So you seek to balance the way you feel.

There are hundreds of such situations we face in our daily lives. Life is indeed like a tightrope walk. If you lean to one side, you are bound to fall. So save yourself from leaning to one side, and maintain a

balance between the two sides. This is the only formula for a safe journey through life.

For example, a student who failed in an examination thinks of killing himself due to deep frustration. Then he remembers the well-known saying: Try, try, try again. He then starts rethinking his future plans, and says, 'If I have lost the first chance, there is every possibility that I will be able to avail of the second chance.' He then starts studying with renewed diligence, appears in the second examination and passes with good marks. This student was able to maintain a balance between two opposite choices and was saved.

According to the common dictionary, a tightrope walk is an item of entertainment. But there is another dictionary—the dictionary of wisdom. In this dictionary, tightrope walks means 'living with wisdom'. A dictionary of words can enhance your vocabulary, but a dictionary of wisdom gives you a chance to achieve success while remaining unaffected by the vicissitudes of life.

Everyone is full of desires, but the world outside of us is full of realities. You have to maintain a wise balance between your personal desires and external realities. This is the real art of life. This is an art which is required by everyone, be he a leader or a common man, a wealthy person or a poor man, an educated or an uneducated person.

On balance, life is the same for all. Almost everyone is destined to face the similar situations, so everyone would be well advised to adopt this very formula of tightrope walking

● *The best way to not feel hopeless is to get up and do something. Don't wait for good things to happen to you. If you go out and make some good things happen, you will fill the world with hope, you will fill yourself with hope*

Barack Obama,
U.S. President, Democrat

SACRED SPACE

CLOSE CONTEST

● *In order to become a success, a business doesn't just have to do well, it has to do better than its competitors. Being number one isn't just about bragging rights. Often it means the difference between prospering and*

merely hanging on.

Mitt Romney,
U.S. Presidential Candidate

● *You were placed on this earth to create, not to Compete.*

Robert Anthony

● *If you want to be incrementally better: Be competitive. If you want to be exponentially better: Be Cooperative.*

શ્રી બોરીવલી-દહીસર પાટણ જૈન મિત્રમંડળ...

શુભ શરૂઆત

શ્રી બોરીવલી - દહીસર પાટણ જૈન મિત્રમંડળ - બોરીવલી તથા દહીસર વિસ્તારમાં પાટણના ૨૫૦ જૈન પરિવારો વસવાટ કરી રહ્યા છે. આ પરિવારોના સંગઠનની સાથે સાથે તેઓ સતત પરસ્પર પરિચયમાં રહી ફેલોશીપ પ્રવૃત્તિઓ દ્વારા વિકાસ સાધી શકે તેવા ઉમદા હેતુથી આ મિત્રમંડળની સ્થાપના થઈ રહી છે.

મુંબઈ મધ્યે દરેક વિસ્તારોમાં મિત્રમંડળો અસ્તિત્વમાં છે અને તેઓ માતૃ સંસ્થા શ્રી પાટણ જૈન મંડળના સહયોગ અને સંપર્કમાં રહી પોતાના વિસ્તારોમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. બોરીવલી-દહીસર મિત્રમંડળ પણ આ જ વિચારધારા સાથે આ વિસ્તારના પાટણના જૈન પરિવારોના વિકાસાર્થે વિવિધ આયોજનો હાથ ધરશે.

આ સંસ્થાના સભ્ય થવા માટે હવે પછીના પ્રતિબિંબમાં વિગતવાર માહિતી આપવામાં આવશે. આ વિસ્તારના દરેક પરિવારોને સભ્યપદ મેળવવા નમ્ર વિનંતી છે. આ ઉપરાંત મિત્રમંડળની પ્રવૃત્તિઓને વેગવાન બનાવવા કામ કરવા ઈચ્છતા કાર્યકરોએ નીચે જણાવેલનો સભ્યોનો સંપર્ક રવા વિનંતી.

સંપર્ક : શ્રી રાજુભાઈ - ૯૩૨૨૨ ૨૭૨૦૯
શ્રી મયુરભાઈ - ૯૮૧૯૯ ૬૫૦૦૪
શ્રી જનકભાઈ - ૯૮૨૦૧ ૩૩૭૦૭

દીક્ષા

જૈન શાસનના શિરતાજ તપાગચ્છાચાર્ય ગુરુદેવ શ્રી વિજય પ્રેમ ભુવનભાનુ જયઘોષસુરીશ્વરજી મહારાજના કૃપાપાત્ર પટ્ટાલંકાર યુવાચાર્ય પૂજ્ય શ્રી વિજય હરિકાંતસુરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પાટણના પનોતા પુત્ર અને પુના સંઘના રત્નમુમુક્ષુ જિનેનકુમાર (ઉ.વ. ૨૭)ની દીક્ષા તા. ૨૨-૧-૨૦૧૪ પોષ વદ ૬ બુધવારના પુના ગુરુવાર પેઠ સ્થિત શ્રી ગોડીજી જૈન સંઘ મધ્યે ત્રિદિવસીય ભવ્ય મહોત્સવ સાથે સંપન્ન થયેલ છે. જિતેનકુમારનું નૂતન નામ મુનિવર શ્રી જયકાંત વિજયજી મહારાજ પાડેલ છે. અને તેઓ યુવાચાર્ય પૂજ્ય શ્રી વિજય હરિકાંત સુરીશ્વરજી મહારાજના શિષ્ય બનેલ છે. આ પ્રસંગે મુંબઈ તથા વડોદરાથી ૨૦૦થી વધુ સ્વજનો હાજર રહીને પાટણનું અને શાસનનું ગૌરવ વધારેલ છે. નૂતન મુનિશ્રીની વડી દીક્ષા તા. ૮-૨-૨૦૧૪ના મુંબઈ, અંધેરી (વેસ્ટ) શાંતાવાડી ચંદ્રભ્રમુ સંઘ મધ્યે સંપન્ન થયેલ છે. યુવાચાર્યશ્રીનું નૂતન મુનિશ્રીની સાથે પ્રથમ ચાતુર્માસ અંધેરી (વેસ્ટ), લોખંડવાલા કોમ્પ્લેક્સ મધ્યે થનાર છે. જૈનમ્ જયતિ શાસનમ્.

કોકાના પાડામાં તેમજ પાટણના અન્ય મહોલ્લામાં મકાન લેવા વેચવા

સંપર્ક :

પ્રકાશભાઈ (કોકાનો પાડો)

૦૯૮૨૪૧૫૩૬૩૬

Advt

સંવેદના

દોધુર હૈયામાં મારા,
ક્યારેક કંઈક વર્ષોથી -
રમ્યા કરે, ભમ્યા કરે
અને ગુંજ્યા કરે, આમ જ!

ફોનમાં થતી વાતોની જેમ
દૂરથી બોલાતા, સંભળાતા,
સામર્થ્ય તેમ જ અર્થપૂર્ણ
ઘૂંટાયેલા - ઘેરાયેલા શબ્દો!

કાને અથડાઈ ખરી પડતા,
ઘોર અંધકારના પોલાણમાં
સાબુમાં ઉદ્ભવતા પરપોટા
ફીણની જેમ ફીણોટાઈને!

સદા યુવા રહેવા મથતા,
મારા સ્વપ્નોને વિચારોમાં -
ખોવાઈ જાય છે, સમયની
સંવેદના અને વેદના!

સ્મૃતિના વિસ્મૃત થતાં,
જળ ખળખળ વહી જાય-
એકાંતની ચિરંજીવી ઢાણો
ભમતી નિર્જન અરણ્યોમાં!

મ.ને.

અલ્પા મેરેજ ઓયુરો

આયોજિત

અપરિણીત યુવક યુવતીઓના પરિચય માટે ગેટ-ટુ-ગેટ આ કાર્યક્રમમાં પાટણના તથા અન્ય જૈન સમાજના યુવક-યુવતીઓ પણ ઉપસ્થિત રહેશે જેથી આપને પાત્ર પસંદગીની વિશેષ તક! વધુ વિગતો માટે સંપર્ક : શ્રીમતી અલ્પા શાહ
મોબાઈલ : ૯૮૨૩૨૧૮૭૪૬ (૧૧ થી ૫)
Email : alpashah5@yahoo.co.in Advt

ઘર વેચવાનું છે

કોકાના પાડામાં, સાધવીજી મ. સા. ના ઉપાશ્રયની સામે એક માળનું વેલ ફર્નિશ્ડ ઘર વેચવાનું છે. જેમને ઈન્ટરેસ્ટ હોય તેમણે 9322231943 (RAJESHBHAI) નો સંપર્ક કરવો Advt

વિકલાંગ બાળકોનો યાત્રા-પ્રવાસ

દિશા - વિકલાંગ સમિતિ દ્વારા આયોજીત બેંગ્લોર, મૈસુર અને કૃષ્ણગિરિ તીર્થ યાત્રા-પ્રવાસ લાભાર્થી પરિવાર સેવંતીલાલ કાંતીલાલ ટ્રસ્ટના સંપૂર્ણ સહકારથી તા.૨૫-૦૧-૨૦૧૪ થી તા.૩૦-૦૧-૨૦૧૪ સુધી ખુબ જ સફળ થયો છે.

મંગળવાર, ૨૫ મી જાન્યુઆરીએ સવારના ઉઘાન એક્સપ્રેસ મારફત બેંગ્લોર તરફ પ્રયાણ કર્યું તે પહેલાં શ્રી જે. કે. શાહ, ઉપરાંત દાતા પરિવારના શ્રી લલીતભાઈ પોપટલાલ શાહ, શ્રી ભરતભાઈ નેમચંદ શાહ અને શ્રી બિપીનભાઈ નેમચંદ શાહ તથા અન્ય મહેમાનોની હાજરીમાં બાળકો દ્વારા બનાવેલ મોતીની માળાથી બધાનું સન્માન કરેલ. ટ્રેનમાં દાતા પરિવારના મહેમાનો, બાળકો અને વાલીઓ સહિત કુલ ૮૦ વ્યક્તિઓ હતી. હિન્દુ જિમખાનાના મેનેજર તરફથી આખા દિવસનો નાસ્તો અને ડીનર લઈ, માનવંતા દાતાશ્રીનો જન્મદિવસ હોઈ, તેમનું બહુમાન કર્યું. બેંગ્લોરથી મૈસુર જતા રામનગર દર્શન, પૂજા તથા બપોરનું જમણ કરીને મૈસુર પહોંચ્યાં. ત્યાંની ઉત્તમ ધર્મશાળામાં ઉતારો હતો. રાત્રીના વૃંદાવન ગાર્ડનની મુલાકાત, ત્યાંનું વાતાવરણ, લાઈટીંગ, ફુવારા જોવાનો આનંદ મોહનીય હતો. બીજા દિવસે રાજાનો પેલેસ જોવાની બધા બાળકોને ખુબ જ મજા આવી. મૈસુરમાં જૈન ભાઈઓ સંચાલિત મહાવીર આઈ હોસ્પિટલની રૂ.૧૦૦૦/- લઈ આંખના ઓપરેશનો કરી માનવ સેવા થાય છે. આજ સુધી લગભગ ૬૦ હજાર ઓપરેશન કરેલ છે. અમોએ પણ શ્રી પાટણ જૈન મંડળ ૧૦૨ વર્ષની ઉજવણી નિમિત્તે મંડળવતી દરેક વાલીઓના સાથસહકારથી શ્રી જે.કે.શાહના માર્ગદર્શનથી રૂ.૩૫,૦૦૦/- આપી ૩૫ ઓપરેશનનો લાભ લીધેલ. ત્યાંના ટ્રસ્ટીઓએ પણ અમારૂં સ્વાગત કરી અમારા માટે બે બસની સગવડ કરેલ. ત્યાંથી બેંગ્લોર સુશીલધામમાં વિશાળ રૂમોમાં ઉતારા લઈ, સુંદર સંગેમરમરનું દેરાસર, મૂળ નાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની ત્યાં સેવા-પુજા આદિનો બાળકોએ સુંદર લાભ લીધો. ભોજનશાળામાં નવકારશી, ભોજન, ખાવાપીવાની ઉત્તમ વ્યવસ્થા હતી. વિશ્વેસ્વરીયા મ્યુઝીયમમાં આધુનિક ટેકનોલોજી સુંદર રીતે સમજવામાં આવી. ત્યાંનો

શ્રીડી શો જોવાની દરેક બાળકોને મજા આવી. ઈસ્કોનની મુલાકાત લીધી. પછીના દિવસે કૃષ્ણગિરિની મુલાકાતે ગયા. પદમાવતી માતાના ૨૭ રૂપના અલગ અલગ નામની પ્રતિમા વચ્ચે સહસ્ત્રફણા પાર્શ્વનાથ દાદાની અદ્ભુત પ્રતિમાની સેવા-પૂજા કરી. આપણા બાળકોએ બનાવેલ હાર ચઢાવીને દાતાઓએ લાભ લીધો. ત્યાંની સિધ્ધાયલમ, શત્રુંજય તીર્થની આબેહુબ રચના અને ૧૦૮ અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવાનનું વિશાળ જિનાલય નિહાળવાનું આ યાત્રા દરમ્યાન શક્ય બન્યું. શ્રીમતી પ્રફુલ્લાબેન લલીતભાઈ, તેમના પુત્રવધૂ શ્રીમતી નીતાબેન કેતનભાઈ શાહની પ્રેરણાથી સંપૂર્ણ આયોજન શક્ય બન્યું. તેઓએ લીધેલ જહેમત અને કરાવેલ યાત્રા બદલ તેમની ભૂરિ ભૂરિ અનુમોદના.

શ્રીમતી નીતાબેનનો દરેક બાળકને બને તેટલી સગવડ આપવાનો અભિગમ અને લાગણીશીલ સ્વભાવ અમો કદાપી ભુલી નહી શકીએ. આ પ્રવાસ દરમ્યાન તેમના મહેમાન તરફથી ગિફ્ટો તથા દરેક બાળકને આશરે રૂ.૧૮૦૦/- થી સંઘપૂજન કરેલ. આ પ્રવાસની બીજી ખુબી એ હતી કે દરેકને બેંગ્લોરથી મુંબઈની મુસાફરી પ્લેનમાં કરાવી. બાળકોનો ઉત્સાહ અનેરો હતો. ૮૦ ટકા વાલીઓએ પણ વિમાનનો પ્રવાસ પહેલી વખત જ કર્યો હતો. પ્લેન ચાલુ થયું ત્યારે બધા જ ભુલકાઓ અને વાલીઓએ આનંદથી તાળીઓના ગડગડાટથી વધાવ્યું. અન્ય પ્રવાસીઓએ પણ લાગણીથી કહ્યું કે, તમારું ટ્રસ્ટ આટલું સુંદર કાર્ય કરે છે અને આ ટ્રસ્ટને ૧૦૨ મું વર્ષ ચાલે છે, જાણીને તેઓ પણ ગદગદીત થયા.

સેવંતીલાલ કાંતીલાલ ટ્રસ્ટ છેલ્લા ૮૦ વર્ષથી કાર્યરત જનહિતના સુંદર કાર્યો સાથે અનુપમ લાગણીઓ થકી આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં સંસ્થા પ્રત્યેનો પ્રેમ પાંગરતો રહ્યો છે. પાટણ ખાતે બાલમંદિર, બ્લડ બેન્ક, એસ.કે.કોલેજ ઓફ બીઝનેસ મેનેજમેન્ટ, તેમની દરેક શૈક્ષણિક સંસ્થા સુંદર કાર્ય કરે છે. પાટણ તેમની કર્મભૂમિ છે. શ્રી પાટણ જૈન મંડળના શૈક્ષણિક ફંડમાં અનન્ય યોગદાન આપેલ છે. જેમાંથી શિક્ષણ સહાય, નોટબુક સહાય પાટણ સમાજમાં આશીર્વાદરૂપ બનેલ છે. ટ્રસ્ટની બધી જ સેવાઓ નેત્રદિપક છે. તેમના પરિવારના દરેક સભ્યો તન-મન-ધનથી મંડળની પ્રવૃત્તિઓ સાથે નખશીખ સંકળાયેલ છે.

શ્રી પાટણ પાંજરાપોળ સંચાલિત આઝાદ ચોક, પીંપળાશેરી, પાટણ (ઉ.ગુ.)-૩૮૪૨૬૫ ● ફોન:(02766)220203

શ્રીમતી કુસુમબેન અમૃતલાલ શાહ પશુ આશ્રય સંકુલ (બલીપુર)

કાર્યાલય : મે. પ્રવીણચંદ્ર એન્ડ કું., ૨૧, ભાંગવાડી શોપિંગ આર્કડ, કાલબાદેવી, મુંબઈ-૪૦૦ ૦૦૨. ફોન: ૬૬૩૧૭૮૮૦-૮૮. મો.: ૯૮૨૧૦૧૨૫૧૮.

અબોલ, અપંગ, આપાદગ્રસ્ત પશુઓની નિષ્ઠાપૂર્વક સેવા થાય, મૃત્યુની અંતિમ પળોએ આવા જીવોને સમાધિ અપાય ત્યારે તેમના હૈયાના અતલ ઊંડાણમાંથી આશીર્વાદની ધારા, આંખોમાં ડોકાતી પ્રેમની અમૃતધારા અને આર્તધ્યાનમાંથી બચી શૂન્યભાવનાની અંતિમ પળો પામી બંધાતા શુભ આયુષ્ય કર્મના કારણે થતી પૂણ્યની લાગણીથી સેવા કરનાર કે દાતા બની જીવનદાતા બનનાર વ્યક્તિ કે સંસ્થા સ્વ તથા પર કલ્યાણના ભોક્તા બને છે.

- પરિવારમાં જન્મદિનને બનાવો અમારો અભયદિન
- લગ્નોત્સવને બનાવો અમારો જીવનોત્સવ
- સ્વજનના મૃત્યુનો શોક અભયદાનના બળે હળવો બનાવો
- અસહ્ય વેદનામાંથી પશુઓના પ્રાણ ઉગારો
- આપના શ્રીસંઘના જીવદયાની ટીપમાંથી શ્રી પાંજરાપોળને મહદ ફાળો આપવા વિનંતી
- ધાર્મિક મહોત્સવને જીવદયાનો ઉત્સવ બનાવો
- વિકટ સંજોગોમાં આપના આર્થિક સહયોગની અપેક્ષા!
- પશુરોગ સારવાર અને શસ્ત્રક્રિયા કેમ્પ

સંસ્થાને આપેલ દાન ઈન્કમ ટેક્સ એક્ટ ૮૦ હેઠળ કરવેરામાં રાહતનેપાત્ર છે

adv

પશુ-પક્ષીઓ માટેની વિવિધ યોજનાઓ

કાયમી શેડ ફંડ	રૂ. ૧૦૧૦૦૦	દૈનિક લાપસી	રૂ. ૨૧૦૦૦
કાયમી નિભાવ ફંડ	રૂ. ૫૧૦૦૦	દૈનિક ઘાસચારો	રૂ. ૧૫૦૦૦
લાપસી (કાયમી તિથિ)	રૂ. ૩૧૦૦૦	માસિક દવા ચિકિત્સા	રૂ. ૧૧૦૦૦
આધાર સ્થંભ	રૂ. ૩૧૦૦૦	કાયમી ઘાસ ફંડ	રૂ. ૧૧૦૦૦
		કાયમી પક્ષી ચણ	રૂ. ૫૦૦૦

લાભાર્થીના નામ આરસની તકતી પર લખવામાં આવશે

લાભાર્થીના નામ તિથિને દિવસે બોર્ડ પર લખવામાં આવશે

● સૌજન્ય : શ્રી નિરંજનભાઈ અમૃતલાલ શાહ ●

શ્રધ્ધાંજલિ

સમાજના અગ્રણી શ્રી અરવિંદભાઈ જીવાભાઈ (ખેતરવસી) નું ૭૬ વર્ષની જૈફ વયે શનિવાર, તા. ૨૫-૦૧-૨૦૧૪ ના દિને મુંબઈ મધ્યે થયેલ દુઃખદ નિધનની સખેદ નોંધ લેતાં, મંડળ અને સમાજે ઉંડી આઘાતની લાગણી અનુભવી છે. વાત્સલ્યમયી હૈયાના કારણે સૌ સાથે તેઓ આત્મીય સંબંધો સિંચી અને સાચવી શક્યા હતા. સદગતશ્રીના નિધનથી સંસ્થા અને સમાજને કદી ન પુરાય તેવી ખોટ પડેલ છે. તેઓ સ્વભાવે સરળ પરંતુ નિર્ણયમાં સત્યના આગ્રહી અને મકકમ વિચારધારા ધરાવતા હતા.

મંડળની વ્યવસ્થાપક સમિતિના સભાસદ તરીકે જોડાયા બાદ, મંડળમાં સને ૧૯૮૫ માં માનદમંત્રી, કોષાધ્યક્ષ, વિદ્યાલય સમિતિના માનદમંત્રી, બાથ પ્રવૃત્તિના માનદમંત્રી, પાટણ પ્રવૃત્તિ સમિતિ અને ભુકંપ રાહત પ્રોજેક્ટ કમિટીમાં સભ્ય તરીકે તેમજ પાટણ પ્રતિબિંબના માનદમંત્રી તરીકે ઉપરાંત સંસ્થાના ટ્રસ્ટી તરીકે અનુમોદનીય સેવાઓ આપી હતી. સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓમાં તેઓનું યોગદાન અને માર્ગદર્શન પ્રેરણાદાયી રહ્યું હતું.

સદગતશ્રીએ પાટણ કો-ઓપ. બેન્ક લિ.ની સ્થાપનાથી જોડાઈ ચેરમેન, વાઈસ ચેરમેન તથા ડાયરેક્ટર તરીકે અનન્ય સેવાઓ આપી હતી. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સાથે નખશીખ જોડાયેલા હતા. તેઓના વિશાળ પરિવારજનો પર આવી પડેલ દુઃખમાં શ્રી પાટણ જૈન મંડળના સર્વે હોદ્દેદારો, મેનેજિંગ કમિટીના સભ્યો તથા કર્મચારી ગણ સદગતશ્રીને શ્રધ્ધાંજલિ અર્પતા અત્યંત દુઃખની લાગણી અનુભવી શોક પ્રદર્શિત કરે છે.

પરમકૃપાળુ પરમાત્મા સદગતશ્રીના આત્માને ચિર: શાંતિ અર્પે એજ પ્રાર્થના.

□ શ્રી પાટણ જૈન મંડળ

આપઘાત એટલે...

- આત્મવિલોપન, આત્માનો ઘાત, તે જિનાજ્ઞા વિરૂધ્ધ છે.
 - મનની નબળાઈ. મન અતિ મુંઝાય ત્યારે આપઘાત આચરણમાં મુકાય છે.
 - અશુભ વિચારો- કર્મોનું ગુંચવાયેલું જાળું. મનની મુંઝવણ.
 - આયુષ્યનો અધવચ્ચે ઘાત કરવો.
 - મન અને કાયાના બળનો દૂર ઉપયોગ, સુંદર સશક્ત કાયાનો ધ્વંસ.
 - ઉંઘી દિશા તરફ પ્રયાણ. દરિયામાં તરતી જીવનરૂપી નાવને ડૂબાડવી.
 - અવિચારી, અવિવેકી પગલું.
 - મનમાં જામેલા આંધીના તોફાનને વેગ આપવો.
 - સ્વજન-પરિવારનો વિલાપ-આર્કંદ તથા સાત નીચ ભવોને આમંત્રણ.
 - દુર્લભ મનુષ્યભવને સુલભ નરકાગામી બનાવવું.
 - અશુભ સમાચારના માધ્યમે છાપે-છાપરે ચઢવું.
 - મનને કોરી ખાતો અસંતોષનો ઉધઈ-જીવડો
 - અસમાધિ મરણને આમંત્રણ અને અધ્યાત્મ જીવનનું વિસર્જન.
 - આધી, વ્યાધિ, ઉપાધિનો મિત્ર-મનની અસ્થિરતા અને ધીરજનો અભાવ.
- સાચું આત્મજ્ઞાન અને વિવેકબુદ્ધિ હોય તે આપઘાત કરવા પ્રેરાય જ નહિ. પ્રબળ પુણ્યોદયે મળેલા અને દશે દૃષ્ટાંતે દુર્લભ એવા માનવભવને પ્રભુએ બક્ષિસમાં આપ્યો છે. તો શું તેમની આપેલી અણમોલ બક્ષિસને આપઘાતરૂપી કચરાપેટીમાં નાખી દઈશું, નહિ, નહિ, કદાપિ નહિ. ઉચ્ચગતિ મેળવવી હોય તો પ્રભુના જીવનચરિત્રો વાંચો અનેક મરણાંક કષ્ટો આવ્યા પણ કદાપિ ખરાબ વિચાર નહિ સમભાવે સહન કરી કર્મો ખપાવ્યા. આથી જે તેમના ગુણોનું આત્મવિલોપન કરો. જરૂર ભવાંતરમાં શીઘ્ર મોક્ષગામી બનશું. એજ અભ્યર્થના.

□ શ્રીમતી ઉર્મિલાબેન દીરેન્દ્રભાઈ ઝવેરી

શ્રી પાટણ પંચાયત ફંડ સંચાલિત શેઠાણી હિરાલક્ષ્મી પુનમચંદ કોટાવાળા જૈન ભોજનશાળા

તાંગડિયા વાડો, પાટણ-ફોન : ૦૨૭૬૬-૨૨૫૮૫૩

નૂતન સહાય યોજના

મુખ્ય આધાર સ્થંભ : રૂ. ૩,૧૧,૦૦૦/- ● સહાયક આધાર સ્થંભ : રૂ. ૧,૧૧,૦૦૦/-

કાયમી તિથિ : રૂ. ૩૧,૦૦૦/- ● દાતા ફોટો યોજના : રૂ. ૩૧,૦૦૦/- રકમ આપનાર દાતાનો ફોટો ભોજનશાળા હોલમાં મૂકવામાં આવશે.

વાર્ષિક ચતુર્વિધ સંઘ ભક્તિ સહાયક યોજના : રૂ. ૨,૫૦૦/- ચતુર્વિધ સંઘ ભક્તિનો એક દિવસની તિથિનો લાભ મેળવી શકો છો.

તિથિના દિવસે બોર્ડ પર લાભાર્થીના નામ લખવામાં આવશે.

આ સંસ્થાને અપાતું દાન ૮૦-જી અનુસાર કરવેરામાં રાહતને પાત્ર છે

સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એટલે કે ચતુર્વિધ સંઘ જૈની ગણના જૈનશાસ્ત્રમાં પચ્ચીસમાં તીર્થંકરની બરાબર કરવામા આવેલ છે. એ ચતુર્વિધ સંઘની ભક્તિનું ઉત્કૃષ્ટ કાર્ય આપણા વડીલોએ સ્થાપેલ પાટણની આ ગૌરવવંતી સંસ્થા છેલ્લા ૧૧૦ વર્ષથી કરતી આવી છે. આપશ્રી પણ આપની ભાવના અનુસાર ઉપરોક્ત કોઈપણ યોજનામાં સહયોગ આપી સમાજસેવાનું અતિ ઉત્કૃષ્ટ કાર્ય કરી શકો છો.

વધુ વિગત માટે સંપર્ક : શ્રી મહેન્દ્રભાઈ કસ્તુરચંદ શાહ - મો. ૯૮૨૧૦૧૨૫૧૮

● સૌજન્ય : મે. પ્રદીપકુમાર ફાર્મા પ્રા. લિ. તથા મે. કે. સેવંતીલાલ એન્ડ કું., મુંબઈ ●

ADVT

HORN.... "NOT" OK....PLEASE

The title seems to be opposite of what we normally read behind many trucks, but in today's time, when the Central Pollution Control Board declared **Mumbai** as "**The noisiest city in the world**", this title seems to be 'appropriate'.

Mumbai city is unfit for living, at least on the cacophony front. The **city's decibel levels touch 100 decibels** during peak hour traffic. Anything higher than 80 decibels is hazardous. *The World Health Organisation estimates that seven million people lose their lives annually due to noise pollution.*

As we all know, Noise pollution is a nuisance to the environment caused by noise or sound that resulted in discomfort for living in the vicinity.

According to 'Traffic Infra Tech magazine', In India, *Indiscriminate honking, firecrackers and use of loudspeakers during festivals* were identified as the three main contributors to noise pollution.

The impact of noise pollution.

The maximum safe threshold for humans is 80 decibels. For those who work above the limit, in the long run will have a *hearing loss*. The results of epidemiological studies in the US said, emotional instability caused by exposure to loud noise will cause *stress*. When coupled with the narrowing of blood vessels, it can stimulate the heart to work harder to pump blood throughout the body. For a long time, the *blood pressure will go up* and there will be *hypertension*.

Numerous studies have documented the heart-related, respiratory, neurological and other physiological effects of noise. Anger and frustration, lower resistance to disease and infection, headaches and many other physiological and psychological problems have been linked directly to noise. In addition, children have been shown to suffer from slower language development and disruption of learning as a result of noise.

Permissible noise levels in Mumbai city.

Residential Zone – 55 decibels Day time & 45 decibels Night time.

Commercial Zone – 65 decibels Day time & 55 decibels Night time.

Silent Zone – 50 decibels Day time & 40 decibels Night time.

How to measure noise level

One can download a free noise meter app on smart phones or buy noise meter available in the market for approx Rs. 3,000/-.

Tips for controlling Noise pollution

- Transport department should enforce a strict ban on vehicle horns that emit decibels higher than prescribed limits so that *automobile companies equip their vehicles only with horns that meet the norms.*

- Noise pollution can be controlled through reduction at the source. Reengineering machines and use of new technologies that reduce noise at the source.

- Experts recommend a multifaceted approach, including *spreading awareness amongst motorists for unnecessary honking.*

Legal remedies

Last resort is to lodge a complaint with the Mumbai Police Noise Pollution helpline No. 22621855 or Awaaz (NGO) No. 9821520805 or police control room on 100 or 103 and get complaint number to follow up. One can also file complain on Mumbai police's official website or at magistrate's court under the *Environment Protection Act 1986.*

Coping with noise pollution.

- If some one is living in a noisy localities, sound-proof home by replacing older windows with energy-saving models.

- One can use hearing protection - ideally, moulded by an audiologist with little filters that allow to hear perfectly but at a lower volume.

Tips for improving health to fight with noise pollution.

- Get a few minutes of silence every day to rest the ears as our ears are always on, even when we sleep.

- Try practicing meditation everyday.

- Play a game called Mixer. "In any rich soundscape, try to disentangle the various sound sources, as if you are an engineer at a mixing desk with a fader for every individual sound".

So folks, I hope this information helps you to combat with rising noise pollution in our today's modern era.

-VIRAL NARENDRA JHAVERI

મકાન વેચવાનું છે

**પાટણમાં ફોફલિયા વાડો, વખતજીની શેરીમાં
એક મકાન (દેરાસરની નજીક) વેચવાનું છે.**

સંપર્ક : હરેશ શાહ

09822256990

ADVT



સાભાર સ્વીકાર



રીવોલ્વીંગ (એજ્યુકેશન) ફંડ

૭૦૦૦૦૦ શ્રી પન્નાલાલ પૂનમચંદ ચેરિટેબલ ફંડ (ખજૂરીનો પાડો)

સમાજ ઉત્કર્ષ કોરપસ ફંડ

૨૫૦૦૦૦ શ્રીમતી મંજુલાબેન દિલીપભાઈ મોહનલાલ હેમચંદ શાહ
હ.: શ્રી પીયૂષભાઈ દિલીપભાઈ શાહ (મારફતીયા મહેતાનો પાડો)

મેડિકલ સહાય કોરપસ ફંડ

૨૫૦૦૦૦ શ્રીમતી મંજુલાબેન દિલીપભાઈ મોહનલાલ હેમચંદ શાહ
હ.: શ્રીમતી કૃપાબેન પીયૂષભાઈ શાહ (મારફતીયા મહેતાનો પાડો)

સિદ્ધહેમ જ્ઞાનપીઠ ભેટ

૧૦૦૦૦૦ શ્રી મહાસુખલાલ પોપટલાલ શાહ (વાસુપૂજ્યની શેરી)

૧૦૦૦૦૦ શ્રી બાણગંગા આરાધક સંઘ (વાલકેશ્વર)

૫૧૦૦૦ શ્રી શિરીષભાઈ રસિકલાલ શાહ પરિવાર (ઝવેરીવાડો) કલકત્તા

શ્રી વિકલાંગ ઉત્કર્ષ ભેટ-આર્થિક સહાય ભેટ

૨૦૦૦૦ શ્રી દીપકભાઈ જિતેન્દ્રભાઈ શાહ, બીનાબેન, પારસભાઈ તથા શ્રેણિકભાઈ (શિકાગો-યુએસએ) (વખતજીની શેરી)

૧૧૦૦૦ શ્રી હસમુખભાઈ મહાસુખલાલ શાહ (અબજી મહેતાનો પાડો)
સ્વ. શ્રીમતી પુષ્પાબેન હસમુખભાઈ શાહની બીજી પુણ્યતિથિ નિમિત્તે ફાગણ સુદ ૧૦. હસ્તે : શ્રીમતી સોનલબેન ધિરેનભાઈ શાહ-શ્રીમતી પારુલબેન બિમલભાઈ શાહ

૫૦૦૦ શ્રી હર્ષભાઈ યોગેનભાઈ શાહ (કસુંબિયા વાડો)

સ્વ. શ્રી યોગેનભાઈ પોપટલાલ શાહ તથા

શ્રીમતી અરુણાબેન યોગેનભાઈ શાહના સ્મરણાર્થે

વૃદ્ધજન સહાય ભેટ

૫૦૦૦ શ્રી રસિકલાલ જેઠાલાલ શાહ (વસાવાડો)ના ૯૨મા જન્મ-દિવસ નિમિત્તે (મહા સુદ ૧૦) તથા સ્વ. શ્રીમતી કુમુદબેન રસિકલાલ શાહ (વસાવાડો) ૧૦મી પુણ્યતિથિ નિમિત્તે હસ્તે : કલ્યાણમિત્ર શ્રી ડી. એન. શાહ

શ્રી પાટણ જૈન મંડળ

પ્રોગ્રામ સમિતિ આયોજિત

શ્રીમતી કમળાબેન પ્રેમચંદ નગીનદાસ તેલીયાવાળા પ્રેરિત

સત્યાવીસમો સમૂહલગ્ન સમારોહ

શ્રી પાટણ જૈન મંડળ દ્વારા સમાજના તમામ સ્તરના કુટુંબો માટે સત્યાવીસમો સમૂહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.

દિનાંક : સંવત-૨૦૭૦, વૈશાખ વદ-૧૨

રવિવાર તા. ૨૫-૦૫-૨૦૧૪. સમય : સવારે

સમૂહ લગ્નમાં જોડાવા અંગેના ફોર્મ મંડળના કાર્યાલયમાંથી મેળવી લેવા

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૧-૦૩-૨૦૧૪ છે.

વધુ માહિતી માટે સંપર્ક :

શ્રી પાટણ જૈન મંડળ કાર્યાલય-૨૨૮૧૧૩૪૬

શ્રી પંચાસરા પા શ્ર્વનાથ શ્રુત આરાધક મંડળ

C/O. ચંપકલાલ કે. શાહ, ૨/બી, મેકર એપાર્ટમેન્ટ, ૨૩૨, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦ ૦૦૬. ટે. નં. ૨૩૬૯૧૧૦૩. મો. ૯૭૫૭૩૦૪૩૯૯

સહર્ષ જણાવવાનું કે આ સંસ્થા તરફથી સમ્યગ્દર્શન નિર્મળ કરવા મોટી ઉમરના સાધર્મિકોને આઠ-આઠ વર્ષોથી વિવિધ તીર્થોની યાત્રાઓ પાટણના ઉદારદિલ દાતાઓના સહકારથી કરાવી શક્યા છીએ. અમે સર્વે દાતાઓનો આભાર માનીએ છીએ.

આ વખતે પંજાબના કાંગડા આદિ તીર્થોની યાત્રા યોજેલ છે જેમાં કુલ ૧૪૫ યાત્રિકો જોડાયા છે. આ યાત્રામાં ૬૦ થી ૬૫ સાધર્મિકોનો ખર્ચ રૂ. સાત લાખનો થશે, જેમાંથી અત્યાર સુધી પ્રાપ્ત થયેલ ડોનેશનો ઉપરાંત હજુ રૂ. ત્રણ લાખની જરૂર છે. લાભ લેવા શ્રી ચંપકભાઈનો સંપર્ક સાધવા વિનંતી છે.

યાત્રાપ્રવાસના દાતાઓ

રૂ. ૭૧૦૦૦ શ્રીમતી ભગવતીબેન કાંતિલાલ શાહ, હ. હેમંતભાઈ જૂહુ, સાલવી વાડો

રૂ. ૫૧૦૦૦ શ્રી ચંદ્રકાંતભાઈ ચીમનલાલ શાહ, હ. અમીતભાઈ, વાલકેશ્વર, પોળની શેરી

રૂ. ૩૧૦૦૦ શ્રી દિનેશભાઈ રસિકલાલ શાહ, (શ્રી. પાટણ જૈન મંડળ પ્રમુખ) વાલકેશ્વર, ડંકમહેતાનો પાડો

રૂ. ૩૧૦૦૦ શ્રી જતીનભાઈ પોપટલાલ શાહ, ગોરેગાંવ-કનાસાનો પાડો

રૂ. ૩૧૦૦૦ શ્રી શશિકાંતભાઈ નેમચંદ બેંકર, તારદેવ-મારફતીયા મહેતાનો પાડો

રૂ. ૩૧૦૦૦ શ્રી પ્રવીણભાઈ કેસરીચંદ શાહ, મરીનડ્રાઈવ-ઢંઢેરવાડો

રૂ. ૨૫૦૦૦ શ્રી શાહ ખાતે, વાલકેશ્વર, રૂ. ૨૫૦૦૦ શ્રી શાહ ખાતે, વાલકેશ્વર,

રૂ. ૨૧૦૦૦ શ્રી સુશીલાબેન બાપુલાલ શાહ, હસ્તે : રચનાબેન, મલ્લાતાનો પાડો

રૂ. ૧૧૦૦૦ શ્રીમતી સંગીતાબેન ચંદ્રકાંત મૂળચંદ શાહ - દાદર

રૂ. ૧૧૦૦૦ શ્રીમતી વિમળાબેન ચીનુભાઈ - બોરીવલી

રૂ. ૧૧૦૦૦ શ્રીમતી ઈંદિરાબેન ભણશાલી તથા શ્રીમતી કલ્પનાબેન મોરખીયા

રૂ. ૧૧૦૦૦ શ્રી કીર્તિલાલ નાનાલાલ - ચર્યગેટ

રૂ. ૧૧૦૦૦ શ્રી દિનેશભાઈ કાંતિલાલ - ખેતરવરી

રૂ. ૧૧૦૦૦ શ્રીમતી લીલાવતીબેન રેવંતીલાલ શાહ

હસ્તે : દીપકભાઈ, કનાસાનો પાડો

રૂ. ૧૧૦૦૦ શ્રીમતી ભગવતીબેન વિનોદચંદ્ર શાહ હસ્તે : શ્રી દાનેશભાઈ, કનાસાનો પાડો

Advt

ઘવાયેલા કે તકલીફમાં આવેલા પશુ કે પક્ષીઓને નિહાળો તો તેમની તત્કાલ નિ:શુલ્ક સારવાર મળે તે માટે નીચે મુજબ મોબાઈલ નંબર પર સંપર્ક સાધો.

શ્રી સંદિપભાઈ રમેશભાઈ શાહ

૯૮૨૦૦ ૩૮૨૭૫ - ૯૩૨૨૫ ૨૨૦૦૮

૨૪ કલાક પશુ-પક્ષી હેલ્પ લાઈન : ૮૬૫૫૩ ૭૦૦૦૫ / ૦૬

વેટરનરી ડોક્ટર તેમજ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે.

(ફક્ત ચર્યગેટથી વિરાર-પશ્ચિમ મુંબઈ સુધી જ.)

ALPHABET SAYS

A	Says Appreciate Good Thing	N	Says not to think Negative
B	Says Be a Bold & Brave	O	Says Be an Obedient
C	Says Be Creative	P	Says Think Positive
D	Says Delay is Dangerous	Q	Says Be a Qualified
E	Says Enjoy the Life	R	Says Respect All
F	Says Be a Faithful	S	Says Be Satisfied
G	Says Be a Great	T	Says Be a Thankful
H	Says Be a Helpful	U	Says Be Useful
I	Says Be an Ideal	V	Says Victory
J	Says Be a Joyful	W	Says Be Wise
K	Says Be a Kind	X	Says Think everyday is Xmas
L	Says Love each other	Y	Says Be Young
M	Says Be a Modest & Mild	Z	Says Be Zenith

□ SURESH SURAJMAL CHODHARI

શ્રદ્ધાંજલિ

સમાજની નીચે જણાવેલ વ્યક્તિઓના દુઃખદ અવસાનની સખેદ નોંધ લઈ, પરિવારના દુઃખમાં સહભાગી થઈ સંવેદનાની લાગણી વ્યક્ત કરીએ છીએ. પરમકૃપાળુ પરમાત્મા સદ્ગતના આત્માને ચિરશાંતિ અર્પે એ જ પ્રાર્થના !

જ્ઞાતિ	મહોલ્લો	સ્વર્ગસ્થનું નામ	વય	સ્થળ	તારીખ	તિથિ
સાલવી	સાલવી વાડો	દિનેશભાઈ ગોપાલદાસ સાલવી*	૬૬	અમદાવાદ	૧૯-૧૧-૧૩	કારતક વદ-૦૨
વિશાપોરવાળ	ખેતરવસી	નીરુબેન ચંદ્રકાંતભાઈ સંઘવી	૭૧	મુંબઈ-ભૂલેશ્વર	૧૬-૦૧-૧૪	પોષ સુદ-૧૫
દશાઓસવાળ	ખજૂરીનો પાડો	મહેશચંદ્ર જેશીંગલાલ શાહ	૮૩	કલકત્તા	૧૭-૦૧-૧૪	પોષ વદ-૦૧
સાલવી	સાલવી વાડો	રાગીણીબેન ધનવંતભાઈ શાહ	૫૪	મુંબઈ-દર્હિસર	૨૩-૦૧-૧૪	પોષ વદ-૦૭
વિશાઓસવાળ	મારફતિયા મહેતાનો પાડો	ચંદ્રિકાબેન કિશોરકુમાર શાહ	૮૧	મુંબઈ-સાયન	૨૫-૦૧-૧૪	પોષ વદ-૦૯
દશાઓસવાળ	ખેતરવસી	અરવિંદકુમાર જીવાભાઈ શાહ	૭૬	મુંબઈ-ગોવાલિયા ટેન્ક	૨૫-૦૧-૧૪	પોષ વદ-૦૯
વિશાપોરવાળ	વખારનો પાડો	જયશ્રીબેન બિપિનચંદ્ર ઝવેરી	૬૩	મુંબઈ-અંધેરી	૨૬-૦૧-૧૪	પોષ વદ-૧૦
વિશાપોરવાળ	બ્રાહ્મણ વાડો	મૃગાવતીબેન હરિભાઈ શાહ	૮૮	પાટણ	૨૭-૦૧-૧૪	પોષ વદ-૧૧
વિશાશ્રીમાળી	લીમડીનો પાડો	જયંતીલાલ બાપુલાલ શાહ	૭૯	મુંબઈ-વસઈ	૨૭-૦૧-૧૪	પોષ વદ-૧૧
દશાઓસવાળ	કોકાનો પાડો	બચુભાઈ ચંદુલાલ સંઘવી	૭૮	મુંબઈ-ઘાટકોપર	૨૮-૦૧-૧૪	પોષ વદ-૧૨
વિશાશ્રીમાળી	મારફતિયા મહેતાનો પાડો	જિતેન્દ્રભાઈ લક્ષ્મીચંદ શાહ	૬૭	મુંબઈ-ગોરેગામ	૨૮-૦૧-૧૪	પોષ વદ-૧૨
વિશાપોરવાળ	ડંક મહેતાનો પાડો	ધનેશભાઈ ચીમનલાલ શાહ	૭૪	મુંબઈ-વાલકેશ્વર	૦૩-૦૨-૧૪	મહા સુદ-૦૪
વિશાઓસવાળ	ઝવેરી વાડો	મહેન્દ્રભાઈ ગભરૂચંદ શાહ	૭૩	મુંબઈ-વિલેપાર્લા	૦૪-૦૨-૧૪	મહા સુદ-૦૫
વિશાપોરવાળ	ઝવેરી વાડો	દિનેશભાઈ મફતલાલ શાહ	૭૩	મુંબઈ-અંધેરી	૦૮-૦૨-૧૪	મહા સુદ-૦૯
વિશાશ્રીમાળી	કુંભારીયા વાડો	પન્નાબેન ચીનુભાઈ શાહ	૮૧	મુંબઈ-કેમ્સ કોર્નર	૦૮-૦૨-૧૪	મહા સુદ-૦૯
વિશાશ્રીમાળી	કનાસાનો વાડો	સુશીલાબેન સુરેન્દ્રકુમાર ઝવેરી	૮૧	મુંબઈ-સાયન	૦૮-૦૨-૧૪	મહા સુદ-૦૯
વિશાપોરવાળ	કોકાનો પાડો	શૈલેશભાઈ કીર્તિલાલ શાહ**	૫૫	મુંબઈ-અંધેરી	૦૮-૦૨-૧૪	મહા સુદ-૦૯

* ચક્ષુદાન કરેલ છે. * દેહદાન કરેલ છે ● યુવાનીમાં રક્તદાન ● મૃત્યુ બાદ ચક્ષુદાન ● ત્વચાદાન ● અંગદાન ** દેહદાન કરો અને કરાવો

ચક્ષુદાન ક્યાં કરશો ? ● દાદર (વેસ્ટ) ● ડૉ. ગોખલે આઈ બૅંક ● ફોન : ૨૪૨૨૧૮૨૦ ૨૪૨૨૭૪૨૫

ચક્ષુદાન અંગે જેન સમાજ અન્ય કોમની તુલનાએ સારી એવી જાગૃતિ ધરાવે છે

આંખનું જતન કરો! મૃત્યુબાદ ચક્ષુદાન કરો

સમગ્ર હિન્દુ સમાજ માટે પાર્થિવદેહને સ્મશાનભૂમિ સુધી લઈ જવા

મોક્ષવાહિની (અંતિમયાત્રા રથ) સંપૂર્ણપણે વિના મૂલ્ય સેવા

સંપર્ક : લોટા ફાઉન્ડેશન ૮૮૭૯૨૫૬૯૯૨ ● ૯૭૬૯૪૨૮૫૮૯-૧૨૭૮

FLAT FOR SALE

વીલ દ્વારા મંડળને વારસદાર બનાવનાર વિશ્વ સખાવતિ શ્રીમતી પન્નાબેન કપુરચંદ સોનાવાલાનો ફ્લેટ જે હવે શ્રી પાટણ જૈન મંડળના નામે છે.

Details of the Flat

Address: Flat No. 21, 2nd Floor Zenia Abad Co-Op Hsg. Soc. Ltd, L. D. Ruparel Marg, (Little Gibbs Rd.,) Malabar Hill, Mumbai 400 006

Prime Location: Behind WIAA Club & near Hanging Garden, Peaceful natural environment

Area: Carpet 1370 Sq. ft, Built up 1575 Sq. Ft.,
2 Bedrooms with Balcony & attached toilets,
Servant Room with toilet, Kitchen & Hall with large Balcony.

Garage: Closed Garage No. 8 suitable for 2 car parking

About the Society:

Well maintained small Society of 12 flats & 6 floors with 2 lifts.
CCTV Cameras for security.



Please Contact with your offer and for Inspection

Shri Mahendrabhai Nemchand Shah - 9821849991

Shri Ashwinbhai Panalal Shah - 9322229411

સિદ્ધહેમ જ્ઞાનપીઠ-પાટણ

સાધુ-સાધ્વીજી ભગવંતો અને મુમુક્ષુઓને શ્રુતજ્ઞાન પ્રદાન માટે આર્થિક સહયોગ આપનાર મહાનુભાવો

- શ્રી રમણલાલ શાહ (પ્રદીપકુમાર એન્ડ કું.) રિલીજીયસ ટ્રસ્ટ (કુંભારીયા પાડો)
- શ્રી કેશવલાલ કીલાચંદ ચેરીટેબલ ટ્રસ્ટ (કુંભારીયા પાડો)
- મે. કે. સેવંતીલાલ એન્ડ કું. (ચિતારાની ખડકી)
- મે. મિલન જ્વેલર્સ (ઝવેરી વાડો)
- શ્રી ચિરાગભાઈ દિનેશભાઈ શાંતિલાલ શાહ (બ્રાહ્મણ વાડો)
- શ્રી મહાસુખલાલ પોપટલાલ શાહ (વાસુપૂજ્યની શેરી)
- શ્રી બાણગંગા આરાધક સંઘ (વાલકેશ્વર)
- શ્રી શિરીષભાઈ રસિકલાલ શાહ પરિવાર (ઝવેરીવાડો) કલકત્તા
- શ્રી પ્રમોદભાઈ મણિલાલ શાહ (ખેતરવસી)

વિવિધ સંઘના ટ્રસ્ટીઓને આગ્રહભરી વિનંતી આપના જ્ઞાન ખાતાના ફંડમાંથી સિદ્ધહેમ જ્ઞાનપીઠ માટે દાન આવકાર્ય

**SHREE PATAN JAIN MANDAL
SAMAJ VIKAS FUND**

**MEDICINE (DAWA) SAHAY YOJNA &
PUBLIC HEALTH CARE CENTRE FUND**

SHRI PRAVINCHANDRA KESARICHAND SHAH Rs. 1.01 CRORE
BY SHRI TUSHARBHAI AND SHRI JAYESHBHAI [Dhandherwado]

EDUCATION SAHAY CORPUS FUND

SEVANTILAL KANTILAL TRUST Rs. 80 LACS

SAMAJ VIKAS CORPUS FUND

SMT MINABEN & SHRI NITINBHAI JAYANTILAL
GABHRUCHAND SHAH & FAMILY USA (Khetarvasi) Rs. 54 LACS

- Babu Panalal Poonamchand Charitable Trust, Khajurino Pado
- Babu Saheb Nanakchandji Pooranchandji Trust, Khajurino Pado
- Babu Jivanlal Panalal Trust, Khajurino Pado
- Smt. Gunvantiben Pravinchandra Keshrichand Shah, Dhandhervado
- Smt. Hasumatiben Rameshchandra Bapulal Shah,
By : Shrimati Moniakben Sanjaybhai Shah, Dank Mahetano Pado
- Shri Harsukhlal Bapulal Shah and Shrimati Rasilaben Harsukhlal Shah,
By : Shri Nirmalbhair, Shri Anilbhair, Shri Jayeshbhair & Shri Shirishbhair,
Lakhiyar Vado/Kanasano Pado
- Smt. Gulabben Ramanlal Shah, Vakhatjini Sheri
By : Shri Hitenbhair Pravinchandra Shah
- Late Shri Pramodbhair Bhogilal Jhaveri (Sayba), (Chodhrini Sheri)
By : Smt. Maltiben, Smt. Falguniben & Shri Devangbhair Jhaveri
- Shri Mafatlal Chudghar Charitable Trust, Chodhrini Sheri
- Smt. Kusumben Rasiklal Himatlal Shah, Dank Mahetano Pado
By : Shrimati Kalpnaben, Shrimati Ashaben, Shrimati Meetaben
- Smt. Nirmalaben Ravindrabhair Mohanalal Shah, Khajurino Pado
- Shri Virendrabhair Popatlal Shah, Mallatno Pado
- Shri Maulikkumar, Divyabalaben, Navinbhair Shah, Pole ni Sheri
- Smt. Subhadraben Ramanlal Shah Charitable Trust, Kumbharia Pado
- Shri Deepakbhair Champaklal Jhaveri (Manmohanjini Sheri)By: AashishJhaveri
- Shri Rameshchandra Chhabildas Zaveri, Manmohanjini Sheri
- Shri Kirtilal Somchand Shah, Kokano Pado
- Smt. Hansaben Rameshchandra Popatlal Shah,
By : Shri Jitenbhair, Kanasano Pado
- Smt. Vasumatiben Sevantilal Shah, Chitarani Khadki
- Smt. Premlataben & Shri Pratapbhair Punamchand Jaswa (Kasumbia Vado)
- Smt. Lilavatiben Panalal Manilal Shah, Vasavado
- Smt. Hansaben Manaharlal Keshavlal Shah, Lahiarvado
- Late Shri Balubhair Chhotalal Shah,
By : Smt. Hansaben, Khadakhodti no Pado
- Shri Sureshbhair Chimanlal Choksi, Zaveri Vado
- Shri Rakeshbhair Kantilal Shah-Chowpatty.
In Memory of Smt. Geetaben Rakeshbhair Shah
- Late Shri Sevantilal Chhaganlal Shah
By: Shri Sharadbhair and Shri Harshadbhair (Tamboli Vado)
- A Well-Wisher
- Shri Shirishbhair Mafatlal Shah, Panchoti Pado

REVOLVING FUND : Target Rs. 5 Crores

To provide interest free Educational Loan

DONOR	Donation In 5 Yrs.
Smt. Subhadraben Ramanlal Popatlal Shah, Kumbharia Pado	Rs. 25 Lakhs
Smt. Bhagwatiben Vinodbhai Matlivala, Kanasano Pado by Shri Daneshbhair, Shri Bhagyeshbhair, Shri Sureshbhair, Shri Dhirenbhair	Rs. 25 Lakhs
Babu Panalal Punamchand Charitable Fund, Khajurino Pado	Rs. 15 Lakhs
Late Smt. Kamalaben & Shri Kantilal Prabhudas Jhaveri (Dhandher Vado) By Shri Samir Chandrakant Jhaveri	Rs. 11 Lakhs
Dr. Mahendrabhair Chandulal Shah & Dr. Lilaben M. Shah,USA (Lakhiar Wado)	Rs. 10 Lakhs
Late Smt. Jasudben Jamnadas Jhaveri & Late Jamnadas Umedchand Jhaveri (Dhandher Wado) By Late Saraswatiben Jamnadas Jhaveri through her will	Rs. 10 Lakhs
Smt. Kanchanben Kantilal Jhaveri (Maniyati Pado) by Smt. Neenaben, Smt. Kalpanaben.	Rs. 5 Lakhs
Shri Keshavlal Kilachand Charitable Trust Kumbharia Pado	Rs. 5 Lakhs
Smt. Gulabben Chimanlal Valamji Choksi By Smt. Vinaben Sureshbhair Choksi (Zaveri Vado)	Rs. 5 Lakhs
Dr.Smt. Kunjalaben & Dr. Vijaybhair Jayantilal Patni (Manmohanjini Sheri)	Rs. 5 Lakhs
Smt. RohinibenVikrambhair Shah(Dank Mehtano Pado) (In her Memory) By Shri Ronakbhair, Smt. Darshnaben, Shri Shrenikbhair & Smt. Komalben	Rs. 5 Lakhs
Late Smt. Kusumben Vrajlal Shah & Vrajlal Jesinglal Shah (Jafujivala) (Tamboli Vado)	Rs. 5 Lakhs
Smt. Taraben Sevantilal Nathalal Khandwala (Keshu Sheth no pado) By Shri Kandarpbhair	Rs. 12 Lakhs

MEMORIAL FUND

NAME OF THE DONOR	DONATION
• Smt. Pannaben Kapoorchandbhair Sonawala, Manmohanjini Sheri	Rs. 8 Crores
• Smt. Nirmalaben (Deviben), Shamlaji ni Sheri. In memory of Late Shri Dhirajlal Popatlal Shah	Rs. 10 Lakhs

The donors donating in **MEMORIAL FUND** through their will – it can be utilised for special activities of the **MANDAL**

To,

